

એકમ પડતર પદ્ધતિ

-
- ▶ એકમ પડતર પદ્ધતિ એ એક પડતર નક્કી કરવાની પદ્ધતિ છે જે એવા ઉદ્યોગોમાં ઉપયોગી છે કે જ્યાં
 - ▶ [૧] ઉત્પાદન એક જ પ્રકારની વસ્તુનું અથવા એક જ પ્રકારની વસ્તુની કેટલીક વિવિધતાનું થાય છે.
 - ▶ [૨] ઉત્પાદન સમાન હોય અને વસ્તુના ઉત્પાદનનું કાર્ય સતત હોય.
-
- ▶ ઉત્પાદન સમાન હોવાથી અને પડતર એકમ એકસરખાં હોવાથી એકમદીઠ પડતરએ સરેરાશ પડતર હોય છે.



એકમ પડતર પદ્ધતિનો ઉપયોગ થાય તેવા ઉદ્યોગો

▶ ઈંટ બનાવવાનો ઉદ્યોગ

▶ સીમેન્ટ ઉદ્યોગ

▶ સ્ટીલ ઉદ્યોગ

▶ ડેરી ઉદ્યોગ

▶ કાગળની મિલ

▶ ખાંડ ઉદ્યોગ, વગેરે



પડતરનું પત્રક

- ▶ પડતરનાં તત્વો અનુસાર અમુક સમય દરમિયાન થયેલ ઉત્પાદનની વિગતવાર પડતર દર્શાવતું પત્રક એટલે પડતરનું પત્રક



પડતર પત્રકના હેતુઓ:

- ▶ ઉત્પાદનની કુલ પડતર અને એકમદીઠ પડતરની માહિતી આપવી.
- ▶ કુલ પડતરનું અલગ અલગ પડતરનાં તત્ત્વમાં વિભાજન દર્શાવવું.
- ▶ ચાલુ સમયગાળાના આંકડાઓની તુલના પાછલા સમયનાં આંકડાઓ સાથે કરવી.
- ▶ સંચાલકોને વેચાણ કિંમત નક્કી કરવામાં તેમજ ભવિષ્યમાં પૂરો પાડવામાં આવનાર તૈયાર માલની ટેન્ડરકિંમત નક્કી કરવામાં મદદરૂપ.



પડતર પત્રકમાં સમાવેશ નથી થતો તેવી વિગતો:

- ▶ રોકડ વટાવ
- ▶ ચૂકવેલ વ્યાજ
- ▶ માંડી વાળેલ પાઘડી અને પ્રાથમિક ખર્ચા
- ▶ કરવેરાની જોગવાઈ
- ▶ ધાલખાધની જોગવાઈ
- ▶ દાન



-
- ▶ ચૂકવેલ આવકવેરો
 - ▶ ચૂકવેલ ડિવિડંડ
 - ▶ અનામત ખાતે ફેરબદલી
 - ▶ વેચેલ મિલકત પર નફો/નુકસાન
 - ▶ પેન્શન
 - ▶ કાયદા મુજબ ચૂકવેલ નુકસાન
 - ▶ બહાર પાડેલ શેર પર વટાવ
-



અંદાજીત પડતરનું પત્રક

- ▶ ઉત્પાદન કરતી કંપનીઓએ ઓર્ડર મેળવવા માટે ટેન્ડર ભરવાં પડે છે અને તેમાં ટેન્ડર કિંમત એટલે જે ભાવે ઉત્પાદક માલ પૂરો પાડવા માંગે છે તે કિંમત દર્શાવવી પડે છે. ટેન્ડર કિંમત શોધવા માટે કંપની અંદાજીત પડતરનું પત્રક બનાવે છે.
- ▶ અંદાજીત પડતરનું પત્રક બનાવથી વખતે માલસામાન, મજૂરી અને વિવિધ પરોક્ષ ખર્ચની ગણતરી ભૂતકાળની પડતરને આધારે વર્તમાન સંજોગો અને ભવિષ્યમાં થનારા ફેરફારને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે.

